



DC-002-001504

Seat No. _____

B. Com. (Sem. V) (CBCS) Examination

March – 2022

Auditing

(Principles of Auditing) (Old Course) (Core - 11)

Faculty Code : 002

Subject Code : 001504

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

- સૂચના : (1) દરેક પ્રશ્નનાં જવાબ મુખ્ય ઉત્તરવહીમાં જ આપવાનાં રહેશે.
 (2) દરેક પ્રશ્નનાં ગુણ પ્રશ્નની જમણી બાજુ દર્શાવેલ છે.

1 (અ) “નામા પદ્ધતિ એક જરૂરિયાત છે, જ્યારે ઓડિટિંગ એક વૈભવ છે.” 10
 આ વિધાનની સત્યતા ચર્ચો.

(બ) ઓડિટિંગનો અર્થ અને મહત્ત્વ સમજાવો. 10

અથવા

1 (અ) ઓડિટિંગના ફાયદા અને મર્યાદાઓ ચર્ચો. 10

(બ) ઓડિટિંગનું કાર્યક્ષેત્ર સમજાવો. 10

2 (અ) ચાલુ ઓડિટનાં ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો. 10

(બ) ઓડિટ કાર્યક્રમ સમજાવો. 10

અથવા

2 (અ) ઓડિટ કાર્યક્રમ એટલે શું ? તેનાં ઉદ્દેશો જણાવો. 10

(બ) ઓડિટ નોંધપોથી સમજાવો. 10

3 આંતરિક અંકુશ એટલે શું ? આંતરિક અંકુશનાં લક્ષણો અને હેતુઓ જણાવો. 15

અથવા

- 3 (અ) પ્રસારિત મહેસૂલી ખર્ચાઓ સમજાવો. 8
 (બ) આંતરિક ઓડિટનું મહત્વ સમજાવો. 7
- 4 (અ) વાઉચિંગ એટલે શું ? વાઉચિંગ અંગે ઓડિટની ફરજોની ચર્ચા કરો. 8
 (બ) વાઉચિંગનાં લક્ષણો અને હેતુઓ જણાવો. 7

અથવા

- 4 (અ) મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત સમજાવો. 7
 (બ) નીચેના પૈકી કોઈ પણ ચાર વ્યવહારોનું વાઉચિંગ કરો : 8
 (1) દેવીહૂડી નોંધ
 (2) જાંગડ વેચાણ
 (3) લેણીહૂડી નોંધ
 (4) બાંયધરી કમિશન
 (5) પ્રાથમિક ખર્ચ.

ENGLISH VERSION

Instructions :

- (1) Write answer of all the questions in main answer books.
 (2) Right side figures show marks of each question.

- 1 (a) Book keeping is a necessity, while auditing is Luxury". Discuss the propriety of the statement. 10
 (b) Explain the meaning and importance of Auditing. 10

OR

- 1 (a) Discuss merits and demerits of auditing. 10
 (b) Explain scope of auditing. 10
- 2 (a) Discuss the advantages and disadvantages of continuous audit. 10
 (b) Explain audit programme. 10

OR

- 2 (a) What is audit programme ? State its objectives. 10
 (b) Explain audit notes. 10

- 3** What is internal control ? Mention features and objectives of internal control. **15**

OR

- 3** (a) Explain deferred revenue expenditure. **8**
(b) Explain importance of internal audit. **7**

- 4** (a) What is vouching ? Discuss the auditor's duties regarding vouching. **8**
(b) Mention the features and objectives of vouching. **7**

OR

- 4** (a) Explain difference between capital expenditure and revenue expenditure. **7**
(b) Do the vouching of following transactions : **8**
(1) Bills payable notes
(2) Sales on approval
(3) Bills receivable notes
(4) Underwriting commission
(5) Preliminary expenses.
-